JK PAPER LTD.

Nehru House, 4 Bahadur Shah Zafar Marg, New Delhi-1 10002



JKP/SH/2020

28th November 2020

Electronic Filing

Department of Corporate Services/Listing **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Fort. <u>Mumbai</u> – 400 001

Scrip Code No. 532162

National Stock Exchange of India Ltd. "Exchange Plaza" Bandra-Kurla Complex. Bandra (E),

Mumbai - 400 051

Symbol: JKPAPER

Series : EQ

Dear Sirs.

Re: Newspaper Advertisement of Completion of despatch of the Postal Ballot **Notice**

Pursuant to Regulation 30 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copy of the Notice published in The Financial Express newspaper (all editions) dt. 28th November 2020 and The Financial Express newspaper (Ahmedabad Edition, Gujarati translated), dt. 28th November 2020, relating to completion of despatch of Postal Ballot Notice dt. 20th November 2020, to the Members of the Company.

Submitted for your kind information and necessary records.

Thanking you,

Yours faithfully, For JK Paper Limited

(Deepak Gupta) Company Secretary

Encl: a/a



Admn. Office: Ph.: 91-11-66001132, 66001112, 23311112-5, Fax: 91-11-23712680, Website: www.jkpaper.com

Regd. Office : P.O. Central Pulp Mills, Fort Songadh, Dist. Tapi (Guj.)-394660

FINANCIAL EXPRESS

ating flights on the Delhi-Lon-

don route thrice a week. -PTI

BHEL makes India's highest-rated auto transformer

PRESSTRUST OF INDIA New Delhi, November 27

STATE-OWNED ENGINEER-ING firm BHELon Friday said it has set a new record by successfully manufacturing and testing India's highest-rated auto transformer.

"BHEL has successfully manufactured and tested (short circuit) India's highest rating auto transformer at the National High Power Test Lab-

PRESSTRUST OF INDIA

New Delhi, November 27

INDIA'S E-COMMERCE festive

sale season from October 15-

November 15 this year deliv-

ered \$8.3 billion (about

₹58,000 crore) worth of gross

sales for brands and sellers, up

65% from\$5 billion (₹35,000

crore) last year, research firm

the pre-festive forecast of \$7

billion, RedSeer said in its

report titled The Festival of

(₹22,000 crore) worth of gross

sales was registered in Septem-

ber this year, which zoomed to

\$8.3 billion in the festive

billion

period, the report said.

(₹29,000 crore)

was logged in

the first event,

\$1.2 billion

(₹8,700 crore)

in the second

event and \$1.4

billion (₹9,700

crore) and \$1.5

billion (₹10,300

crore) in other events

mart-owned Flipkart.

the festive month.

share (66%), it added.

Diwali.

holding multiple sale events,

timed around Dussehra and

group (including Myntra) and

than 88% of the entire gross

has been very bullish this fes-

\$7 billion of sales but the

actual figures surpassed our

expectations fairly comfort-

ably, showing how comfortable

consumers have become with

shopping online even in this

pandemic hit year," RedSeer

The report said Flipkart

Of the \$8.3 billion,

About \$3.2 billion

This was also higher than

RedSeer said on Friday.

Firsts'.

\$4.2

oratory (NHPTL) at Bina in Madhya Pradesh," it said in a statement. This is a new benchmark in

the global transformer indus-

try, according to the statement. Short circuit test is the most stringent, special type test for power transformers, which is conducted to prove the adequacy for power transformers to withstand abnormal conditions of short circuit

to ensure reliability during

director Mrigank Gutgutia

He added that one clear les-

"And it has proven that with

son from this festive season is

that e-commerce has become

the right assortment at the

right prices which is delivered

quickly in the safety of cus-

tomer's homes, the value

proposition of e-commerce is

it is imperative for brands and

sellers to shift their focus to

online quickly and enable a

seamless online experience for

the customer in order to thrive

million shoppers came from

The report noted that 40

tier II and beyond cities.

in a post Covid-19 world.

Gutgutia emphasised that

very powerful," he said.

more mainstream than ever.

'E-commerce sees \$8.3-bn

sales in festive season'

High rating transformers play a crucial role in bulk power transmission to load centres and bigger cities

their operations in the field. Incidentally, this is BHEL's 21 400 KV class transformer, which has successfully passed

the short circuit test, indicating the company's prowess in the sector.

The 500 MVA 400/220/33 KV auto transformer has been designed and manufactured at BHEL's Bhopal plant for UP Power Transmission Corpora-

formers play a crucial role in bulk power transmission to load centres and bigger cities. BHEL is the largest manu-

These high rating trans-

facturer of power transformers in India and a pioneer in the

Camlin A

KOKUYO

indigenous development of higher rating and specialised transformers, with voltage levels going up to 1,200 KV class. The engineering firm's

transformer plant in Bhopal has a world-class, state-of-theart facility, which is at par with its global peers and is fully equipped to meet the expectations of utilities in India as well as abroad in the entire range of power transformers and shunt reactors.

will operate flights on the

Mumbai-London route thricea

INGERSOLL-RAND (INDIA) LIMITED

using its new Boeing 787-9

Dreamlineraircraft. Currently,

CIN: L05190KA1921PLC036321 Regd. Office: First Floor, Subramanya Arcade, Bannerghatta Road, Bengaluru - 560 029

Members of the Company are hereby informed that pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with the Circular No. 14/2020 dated April 33/2020 dated September 28, 2020, issued by the Ministry of Corporate Affairs and pursuant to other applicable laws and regulations, the Company has sent e-mail on November 27, 2020 through National Securities Depository Limited (NSDL) to the members who have registered their e-mail ID with depositories or

(a) approval to enter into Related Party Transactions with Ingersoll Rand Industrial US Inc (b) approval to enter into Related Party Transactions with Ingersoll Rand Industrial Ireland Limited and (c) re-classify Trane statement annexed to the Notice through Postal Ballot only by voting through electronic means (remote evoting). Postal Ballot Notice has been uploaded on the Company's website www.irco.com

as on November 23, 2020 (cut-off date) to enable them to cast their vote by electronic means and a person who is not a Member as on the cut-off date should treat this Notice for information purposes only.

conducting the remote e-voting process in a fair and transparent manner. The voting through electronic means shall commence on December 1, 2020 (9.00 am IST) and end on December 30, 2020 (5.00 pm IST). The voting by electronic means shall not be allowed beyond 5.00 pm IST on December 30, 2020.

who have not registered their e-mail id or have not received e-mail sent through NSDL may write either to the Company's Registrar and Share Transfer Agents at csg-unit@tsrdarashaw.com or to the Company at Pramod.Hegde@irco.com and obtain the same.

report would be communicated to the Stock Exchanges where the Company's shares are listed and will also be displayed on the Company's website www.irco.com

same were passed at a general meeting of the Members convened in that regard. The resolution, if approved last date of remote e-voting i.e. December 30, 2020.

Any query or grievance connected with the e- voting can be addressed to Ms. Sarita Mote, Assistant Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013. E-mail: evoting@nsdl.co.in, Toll Free No. 1800222990.

For INGERSOLL-RAND (INDIA) LIMITED P.R. SHUBHAKAR General Manager - Corp. Finance

MUTUAL

& Company Secretary

♦ Nippon india Mutual Fund Wealth sets you free

Nippon Life India Asset Management Limited

(formerly known as Reliance Nippon Life Asset Management Limited) (CIN -L65910MH1995PLC220793)

Registered Office: 4th Floor, Tower A. Peninsula Business Park, Ganapatrao Kadam Marg, Lower Parel (W), Mumbai - 400 013.

Tel No. +91 22 6808 7000 • Fax No. +91 22 6808 7097 • mf.nipponindiaim.com

NOTICE CUM ADDENDUM NO. 88

Modification in existing process of change in Bank Mandate

Investors are requested to note that Nippon India Mutual Fund (NIMF) / Nippon Life India Asset Management Limited (NAM India) has decided to modify existing process for change in bank mandate process with effect from December 04, 2020 as follows:

Investor can change bank account details in their account/ folio either through Multiple Bank Account Registration Form or a standalone separate change of Bank Mandate form. In case of standalone change of bank details request, Investors shall provide the supporting documents towards the proof of existing and new bank account. Modifications in this process are as follows:

Existing process

mandate Process

Request letter / Change of bank i. request from investor

Documents to be submitted for new

bank account Original of any one of the following

documents or originals should be produced for verification or copy should be attested by the Bank:

Cancelled original cheque of the new bank mandate with first unit holder name and bank account number printed on the face of cheque OR

Self-attested copy of statement OR

Bank passbook with current entries not older than 3 months

Bank letter duly signed by branch manager / authorized personnel

iii. Documents to be submitted for existing bank mandate currently registered in the folio / account

Original of any one of the following documents or copy should be attested by the bank or originals should be produced for verification:

Cancelled original cheque with first unit holder name and bank

account number printed on the face of cheque OR

Original bank account statement / passbook OR In case such bank account is

already closed, a duly signed and stamped original letter from such bank on the letter head of the bank confirming the closure of said account

Documentation for Change of Bank Documentation for Change of Bank mandate Process

Revised process

Request letter / Change of bank request from investor

Documents to be submitted for new bank account

Any one of the following documents:

Cancelled original cheque OR True copy of Bank Passbook with

current entries not older than 3 months and self-attested OR Self-attested original bank

statement with current entries not older than 3 months Note: Any of the above document as

provided by investor should have first unit holder name and bank account number printed on the proof Documents to be submitted for existing

bank mandate currently registered in the folio / account

Any one of the following documents:

Cancelled original cheque OR

True copy of Bank Passbook with entries and self-attested OR

Self-attested original bank statement with entries OR

In case aforementioned old bank mandate proofs are not available,

investors are requested to visit the nearest NIMF branch along with original and self-attested copies of Proof of Identity (POI) and Proof of Address.

Note: Any of the above document as provided by investor should have first unit holder name and bank account number printed on the proof

With respect to above, investors are also requested to note below points:

- Letter from Bank, attested by banker / branch manager etc. shall not be considered as old and new bank mandate proof
- Handwritten/rubber stamp-based bank passbook or cheque will not be accepted for both old as well as new bank proof
- In case of Minor's folio, bank account of the minor or a joint account of the minor with
- the guardian must be provided for new bank mandate.
- In case any change of bank mandate request is received / processed few days prior to submission of redemption request or on the same day as a standalone request or received along with the redemption request, NAM India will follow a cooling period of 10 working days for validation and registration of new bank account and dispatch / credit of redemption proceeds shall be completed within 10 working days.

wherein investor needs pay-out earlier than 10 working days, investors are requested to contact call centre on 1860 266 0111 (Charges applicable) from Monday to Saturday from 8 am to 9 pm or visit nearest NIMF branch. This addendum forms an integral part of Statement of Additional Information (SAI) and all

For the change of bank mandate and redemption cases subjected to cooling period

the other terms and conditions of the aforesaid document read with the addenda issued from time to time will remain unchanged.

For NIPPON LIFE INDIA ASSET MANAGEMENT LIMITED

(formerly known as Reliance Nippon Life Asset Management Limited) (Asset Management Company for Nippon India Mutual Fund)

read all scheme related documents carefully.

Authorised Signatory

New Delhi

Mumbai

Sd/-

November 27, 2020

Make even idle money work! Invest in Mutual Funds Mutual Fund investments are subject to market risks,

Vistara's Mumbai-London flight thrice a week from Jan 16 VISTARA ON FRIDAY said it week from January 16 onward the full-service carrier is oper-

(IR) Ingersoll Rand

Phone: +91 80 46855100; Fax: +91 80 4169 4399; Website: www.irco.com

POSTAL BALLOT NOTICE

8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 22/2020 dated June 15, 2020 and Circular No. the Company. The Company seeks consent of the members by way of ordinary resolution on the matters relating to

Technologies Company LLC from the 'Promoter and Promoter Group' category as 'public shareholder' category as detailed in Postal Ballot Notice dated November 24, 2020 read together with the explanatory The Company is pleased to offer remote e-voting facility to all those persons who are members of the Company

The Board of Directors has appointed Mr. Natesh K, Practicing Company Secretary as the Scrutinizer for

In compliance with the aforesaid MCA Circulars, the Postal Ballot Notice has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members

The results of the postal ballot shall be declared on December 31, 2020. The results along with the Scrutinizer's

The resolutions passed by the Members through remote e-voting will be deemed to have been passed as if the by requisite majority of Members by means of remote e-voting, shall be deemed to have been passed on the

Bengaluru, November 27, 2020

ability and ease of access to a wide assortment of products," it added. Also, mobile phones contin-

ued to dominate

the percentage share

"This festive sea-

tated by afford-

son was one dic-

(at 46%) of all products across the different platforms, by e-commerce companies, including Amazon and Walowing to a rise in aspiration among new customers. Festive season sees players The report pointed out that

with affordability schemes increasing the share of users from tier II and beyond cities, GMV per customer dropped to ₹6,600 this festive season from Amazon accounted for more ₹7,450 in the year-ago period.

RedSeer said the contribumerchandise value (GMV) for tion of the fashion segment decreased from last year (from 16% last year to 13% this Between the two players, year), owing to factors like Flipkart accounted for a larger Covid-19-related restrictions "The overall growth story ongoing out and gathering for weddings and other festive celtive season. We had forecasted ebrations.

Interestingly, categories like home and home furnishings has "done better than anytime before" due to high demand for upgrading workfrom-home/study-fromhome environments.

VIL ropes in partners to offer bundled digital services to customers

PRESSTRUST OF INDIA New Delhi, November 27

VODAFONE IDEA (VIL) on Friday said it has teamed up with multiple partners in learning and upskilling, health and wellness space to bring an array of digital products and services, with exclusive benefits for its customers.

The move would enable the

telecom operator to enhance

digital engagement, build a

future stream of revenue and

create a brand differentiation, besides positioning it as a larger platform of digital services, beyond the core telephony offerings. VIL's strategic partnerships with players in the areas of learningand upskilling, health and wellness, and business

would enable it to offer bene-

fits and additional proposition to customers. "The company has forged partnerships with upGrad, Udemy, Pedagogy, cure.fit, 1mg, MFine, Eunimart and others, and plans to on-board more partners under each of these areas to enable Vi users get exclusive offers from these players," VIL said in a state-

Vodafone Idea CEO, Ravinder Takkar said, "One of the key pillars of VIL's business strategy is to drive partnerships and digital revenue streams, across segments. This will help us drive more value for our customers and offer growth opportunities for the business". With this, the company is

now bringing a range of new financialem.epap.in



The company has forged partnerships with upGrad,

Udemy, Pedagogy, cure.fit, 1mg, MFine, Eunimart and others, and plans to on-board more partners under each of these areas to enable Vi users get exclusive offers from these players

age service of ferings to address the digital shift in customer behaviour, he added.

"Through our collaboration with the category best across key areas of consumer interest such as learning and upskilling, health and wellness, and business help, Vi will now offer a platform of services for our customers, Takkar said.

To avail the benefits, VIL customers would need to download the Viapp. The offer is available to all prepaid, postpaid Vi users and not attached to any plan or pack, the company said.



in its meeting held on Wednesday, 28th October, 2020.

investorrelations@kokuyocamlin.com

KOKUYO CAMLIN LIMITED

CIN: L24223MH1946PLC005434 Regd. Office: 48/2, Hilton House Central Road, MIDC, Andheri (East), Mumbai - 400 093. Tel. No.: +91-22-6655 7000; Fax No.: +91-22-2836 6579 Web: www.kokuyocamlin.com; E-mail: investorrelations@kokuyocamlin.com

POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Company is seeking approval of its Members through postal ballot by way of a Special Resolution for appointment of Mr. Nobuchika Doi (DIN: 03599835) as Director in Whole-time employment designated as 'Executive Director' for a period of three (3) years effective from 1st November, 2020 to 31st October, 2023 as approved by the Board of Directors of the Company

The Postal Ballot Notice is available on the Company's website https://www.kokuyocamlin.com, website of National Securities Depository Limited ("NSDL") https://www.evoting.nsdl.com and the website of the Stock Exchanges where the equity shares of the Company are listed i.e. BSE Limited ("BSE") (www.bseindia.com) and National Stock Exchange of India Limited ("NSE") In compliance with the Circular No. 14/2020 dated April, 8 2020, Circular No. 17/2020 dated April 13,

2020 and Circular No. 33/2020 dated September 28, 2020 issued by the ministry of Corporate Affairs, the Company has sent the Postal Ballot Notice on 27th November, 2020 only through electronic mode to those Members whose e-mail address are registered with the Company Depositories and whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on 20th November, 2020 ("cut-off date"). The communication of the assent or dissent of the Members would only take place through the e-voting system. The Company has engaged the services of NSDL to provide remote e-voting facility to its Members.

The remote e-voting period commences from 9.00 a.m. (IST) on Sunday, 29th November, 2020 and ends at 5.00 p.m. (IST) on Monday 28th December, 2020. The e-voting module shall be disabled by NSDL thereafter, voting rights of the Members shall be in proportion to the shares held by them in the paid-up equity share capital of the Company as on Cut-off date will be entitled to cast their votes by remote e-voting. Once the vote on the resolution is cast by the Member, he/she shall not be allowed to change it subsequently.

procuring user id and password and registration of e mail ids for e-voting for the resolutions set out in this notice In case shares are held in physical mode please provide Folio No., Name of shareholder, scanned

Process for those shareholders whose email ids are not registered with the depositories for

copy of the share certificate (front and back), PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) by email to investorrelations@kokuyocamlin.com In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of Aadhar Card) to

It is clarified that for permanent registration of email address, the members are however requested to register their email address, in respect of electronic holding with the Depository through their concerned Depository Participants and in respect of physical holding with the Company's Registrar and Share Transfer Agent, M/s. Link Intime India Private Limited (Unit: Kokuyo Camlin Limited), email: rnt.helpdesk@linkintime.co.in Tel No. 91-022-49186270 by following due procedure.

For details relating to e-voting, please refer to the Postal Ballot Notice. In case of any gueries, you may refer the Frequently Asked question (FAQs) for shareholders and e-voting user manual for Shareholders available at the download Section of http://www.evoting.nsdl.com or call on toll free no. 1800-222-990 or send a request at evoting@nsdl.co.in. in case of any grievances connected with the facility for voting by electronic means, please contact Ms. Sarita Mote, Assistant Manager, NSDL, Email: evoting@nsdl.co.in/saritaM@nsdl.co.in, Tel: 91-22-24994890 / 1800-222-990.

The Board of Directors of the Company has appointed Mr. J. H. Ranade, Partner failing which Mr. Sohan J. Ranade, Partner failing which Ms. Tejaswi Zope, Partner of M/s. JHR & Associates as the Scrutinizer for conducting the e-voting process electronically in a fair and transparent manner.

The result of the Postal Ballot will be announced on or before 30th December, 2020 at 5.00 p.m. (IST). The said results alongwith the Scrutinizer Report would be intimated to BSE and NSE and will also be uploaded on the Company's website: https://www.kokuyocamlin.com and on the website of NSDL www.evoting.nsdl.com.

For Kokuyo Camlin Limited

Ravindra V. Damle Vice President (Corporate) & Company Secretary



Place: Mumbai

Date: 28th November, 2020

JK PAPER LIMITED

CIN: L21010GJ1960PLC018099, Website: www.jkpaper.com Regd. Office: P.O.Central Pulp Mills - 394 660, Fort Songadh, Distt. Tapi, Gujarat Admin. Office: Nehru House, 4, Bahadur Shah Zafar Marg, New Delhi-110 002 Phone: +91 11 6600 1132, 2331 1112-5, E-mail ID : sharesjkpaper@jkmail.com

NOTICE OF POSTAL BALLOT

- 1. Notice is hereby given that pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any, of the Companies Act, 2013 read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and General Circular No. 14/2020 dated 8th April, 2020, General Circular No. 17/2020 dated 13th April, 2020 and General Circular No. 33/2020 dated 28th September 2020, issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), the Company has completed the despatch of Notice of Postal Ballot on Friday, 27th November 2020 for seeking the approval of the Members of the Company in respect of business mentioned in the Notice of Postal Ballot dated 20th November 2020, through Postal Ballot by voting through electronic means ("remote e-voting") only. The Company is providing remote e-voting facilities to its Members. The instructions for remote e-voting are given in the Notice of
- 2. The Notice of Postal Ballot is being sent only through electronic mode to those Members, whose names appear in the Register of Members/List of Beneficial Owners as received from National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL") as on Friday, 20th November, 2020 ("cut-off date") and who have registered their e-mail addresses with the MCS Share Transfer Agent Ltd., Registrar and Share Transfer Agent (RTA) of the Company or the Depository Participant(s). In terms of the said MCA Circulars, the requirement of sending the physical Notice of Postal Ballot alongwith the Postal Ballot Form in physical form has been dispensed with till 31st December 2020. Accordingly, the Company has not despatched physical copies of Notice of Postal Ballot and Postal Ballot Form to any Member. A person who is not a Member as on a cut-off date should treat the
- Notice of Postal Ballot for information purpose only. 3. The Notice of Postal Ballot is available on the website of the Company at www.jkpaper.com and on the websites of the Stock Exchanges where the shares of the Company are listed i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com, respectively.
- Notice of Postal Ballot is also available on the website of CDSL at www.evotingindia.com. 4. The remote e-voting period will commence on Saturday, 28th November 2020 from 10:00 AM and end on Sunday, 27th December 2020 at 5:00 PM. The remote e-voting module shall not be allowed beyond the said date and time. The voting rights shall be reckoned on the paid-up value of shares registered in the name(s) of the Member(s) as on the cut-off date. The Company has appointed Shri Namo Narain Agarwal, Company Secretary in Practice, as the Scrutinizer and failing him, Shri Naveen Kumar Rastogi,

Company Secretary in Practice, as the Alternate Scrutinizer, for conducting the Postal Ballot through

- remote e-voting process in a fair and transparent manner. 5. The Results of the remote e-voting will be declared on or before Tuesday, 29th December 2020. The results declared along with the Scrutinizer's Report shall be placed on the website of the Company at www.jkpaper.com and on the website of CDSL at www.evotingindia.com and shall simultaneously be forwarded to the BSE Ltd. and National Stock Exchange of India Ltd.
 - with the Company, are requested to send the scanned copy of the following documents by email to the Company at sharesjkpaper@jkmail.com
 - (i) a signed request letter mentioning their name, folio no. and address; (ii) self-attested copy of the PAN Card and

Manner of registering/updating email addresses:

(iii) self-attested copy of any document (e.g. Aadhar Card, Driving License, Election Identity Card, Passport) in support of the address of the Member.

(a) Members holding shares in physical mode, who have not registered/updated their email addresses

(b) Members holding shares in dematerialized mode, who have not registered/updated their email addresses with the Depository Participant(s), are requested to register/update their email addresses with their Depository Participant(s).

After due verification, the Company will forward the procedure for obtaining their login credentials to their registered email addresses. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Shri Rakesh

Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022- 23058738 / 022-23058542/43. Please write to the Secretarial Department of the Company at Gulab Bhawan (Rear Block), 3rd Floor, 6A, Bahadur Shah Zafar Marg, New Delhi- 110 002 for any assistance. For JK PAPER LIMITED

(Deepak Gupta) Place: New Delhi Date: 27.11.2020 Company Secretary

THE TRAVANCORE-COCHIN CHEMICALS LIMITED (A GOVERNMENT COMPANY) P.B. No. 4004, Udyogamandal P.O., Kochi-683 501, Kerala, India Phone: 0484-2545011

rnone: 0484-2543011 CIN: U24299KL1951SGC001237, GSTIN: 32AAACT6207B1Z1 Email: projects@tcckerala.com, Website: www.tcckerala.com

NOTICE INVITING TENDER Online bids (E-tender) are invited from reputed firms for the supply of the following through Kerala government e-tender portal http://etenders.kerala.gov.in Last date of Name of Work Fixing of Cable Trays and Junction Boxes, Laying of Signal Cables/Control Cables, Glanding and Termination, Fixing / Erection of Instruments 2020_TCCL_399937_1

All the relevant details and the tender document can be downloaded from the site. Amendments/Corrigendum if any will be published only in the website

🔯 Karnataka Bank Ltd.

Dy. General Manager (Projects)

Regd. & Head Office: P. B. No.599, Mahaveera Circle, Kankanady, Mangaluru - 575 002. Ph: 0824-2228222, Fax: 0824-2225588, E-mail: investor.grievance@ktkbank.com Website: www.karnatakabank.com, CIN: L85110KA1924PLC001128

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE

Notice is hereby given that the following share certificate(s) have been reported as lost misplaced and upon request from the shareholder(s)/legal heir(s) the Bank will proceed to issue duplicate share certificate(s) to the below mentioned person(s) unless a valid objection with all supporting documents is received by the Bank at its registered office within 15 days from the date of publication of this notice. No claim will be entertained by the Bank with respect to the original share certificate(s) subsequent to the issue of the duplicate thereof.

01.		00111101				140. 01	Name of the	
No.	No.	From	То	From	То	Shares	Share Holder	
1	30000192	43952		752277	752296	20	MANJUNATH	
l							VENKATRAMANA	
							HEGDE	
2	15142	185245		7262201	7262250	100	NAGESH M S	
		340361		15093103	15093152			
	For The Vernetake Bank Limited							

Prasanna Patil Date: 27.11.2020

FORM A PUBLIC ANNOUNCEMENT (Under Regulation 6 of the Insolvency and Bankruptcy Board of India (Insolvency Resolution Process for Corporate Persons) Regulations, 2016) FOR THE ATTENTION OF THE CREDITORS OF

	VEE RUBBER INDIA F	
1.	Name of Corporate Debtor	Vee Rubber India Private Limited
2.	Date of incorporation of corporate debtor	23/12/2014
3.	Authority under which corporate debtor is incorporated / registered	Registrar of Companies, Ahmedabad, India under the Companies Act, 1956
4.	Corporate Identity No. / Limited Liability Identification No. of corporate debtor	U25199GJ2014PTC081632
5.	Address of the registered office and principal office (if any) of corporate debtor	Rev. Block No. 510, 511, 514 and 516 Village - Kunpur, Taluka - Mandal Kunpur Ahmedabad GJ 382130
6.	Insolvency commencement date in respect of corporate debtor	24/11/2020 (Order uploaded on NCLT website on 26/11/2020)
7.	Estimated date of closure of insolvency resolution process	23/05/2021
8.	Name and registration number of the insolvency professional acting as interim resolution professional	Tejas Shah Reg No. IBBI/IPA-001/IP-P00089/2017-18/10185
9.	Address and e-mail of the interim resolution professional, as registered with the Board	B 201, Narayan Krupa Avenue, Opp. Prernatirth Derasar, Jodhpur, Satellite, Ahmedabad, Gujarat – 380015 Email – tejasshah44@yahoo.com
10.	Address and e-mail to be used for correspondence with the interim resolution professional	Address – 9/B, Vardan Complex, Lakhud Circle, Navrangpura, Ahmedabad - 380014 Email: iptejaskshah@gmail.com
11.	Last date for submission of claims	10/12/2020
12.	of sub-section (6A) of section 21, ascertained by the interim resolution professional	NOT APPLICABLE
13.	to act as Authorised Representative of creditors in a class (Three names for each class)	NOT APPLICABLE
14.	(a) Relevant Forms and (b) Details of authorized representatives are available at:	(a) Web link:www.ibbi.gov.in (b) NOT APPLICABLE

Notice is hereby given that the National Company Law Tribunal has ordered the comme of a corporate insolvency resolution process of the Vee Rubber India Private Limited or 24/11/2020 (Order uploaded on website on 26/11/2020).

The creditors of Vee Rubber India Private Limited are hereby called upon to submit their claim

against entry No. 10. The financial creditors shall submit their claims with proof by electronic means only. All othe creditors may submit the claims with proof in person, by post or by electronic means.

Afinancial creditor belonging to a class, as listed against the entry No. 12, shall indicate its choice of authorised representative from among the three insolvency professionals listed against entry No. 13 to act as authorised representative of the class [NA] in Form CA Submission of false or misleading proofs of claim shall attract penalties.

CA Tejas Shah Date: 28th November 2020 Reg No- IBBI/IPA-001/IP-P00089/2017-18/10185



Regd.office: 3rd Floor, Maker Chambers IV, 222, Nariman Point, Mumbai - 400 021. Phone: 022-3555 5000. Email: investor.relations@ril.com CIN: L17110MH1973PLC019786

NOTICE

NOTICE is hereby given that the following certificate(s) issued by the Company are stated to have been lost or misplaced and Registered Holders thereof have applied for the issue

Vandaria D Mehta Vandaria D	Sr. No.	Folio No.	Name / Joint Names	Shares	Certificate Nos. From - To	Distinctive Nos. From - To
2 3238741	_	14013059	Apurva D Mehta	16	66669558-558	6876365078-093
1298003 B B Sahny 5 14049704-704 33905579			Vandana D Mehta			
18 62095023-023 2183429101 36 667742442-442 6885497231 36 66772442-442 6885497231 37 66774442-442 6885497231 37 67094144 Dhiraj Sarna 105 53840296-298 1263162681 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 110 16618396-398 465751831 162846378-798 2207869416 16467556-464 164631897-798 2207869416 16467566-46 164631189-189 16991599 100 166531189-189 100 166531189-189 100 166531189-189 100 166531189-189 100 166531189-189 100 166531189-189 100 1	2	3238741	Ashoksingh Thakor	9	20142305-305	135158661-669
36 66772442-442 6885497233 3 1298003 B B Sahny 5 14049704-704 33095579 Molly Susan 105 53840296-298 1263162684 4 76094144 Dhiraj Sarna 25 16463110-110 409440353 85 53713682-684 1258359033 5 54188463 Hiralal Nahar 20 50886108-108 1164675566 Leelabai Nahar 40 62463798-798 2007869416 6 33116578 Kirankumar Ambalal Patel Bhagavandas Sevaram Pahuja 30 62342710-710 2195810477 7 33708246 Nina Y Songavker 40 4335515-516 69919593 8 119114180 R S Pahwa 54 57644526-526 1598246814 Arushi 54 62299109-109 2192285953 108 66515742-742 6862180644 Arushi 54 62299109-109 2192285953 108 66515742-742 6862180644 11 1118790 Sona Devi 3 560939-939 116037772 11 1118790 Sona Devi 3 560939-939 16909952 12 63939170 Suresh Prasad 100 62592087-087 2217628167 13 14013041 Vandana D Mehta Apurva D Mehta Apurva D Mehta Apurva D Mehta			· ·	9	54952619-619	1335002097-10
3				18	62095023-023	2183429110-12
Molly Susan				36	66772442-442	6885497235-27
4 76094144 Dhiraj Sarna 25 16463110-110 40944035: 46575183: 46575183: 46575183: 46575183: 46575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 45575183: 4587556: 458758: 40 62463798-798 46575183: 4587562: 684 116467556- 4657589: 40 62463798-798 2207869416 63086108-108 116467556- 462463798-798 2207869416 40 62463798-798 2207869416 40 62463798-798 2207869416 40 62432710-710 219581047: 40 40 4335515-516 6991959: 40 40 4335515-516 6991959: 40 60	3	1298003	B B Sahny	5	14049704-704	330955790-79
10				105	53840296-298	1263162683-78
S	4	76094144	Dhiraj Sarna	25	16463110-110	409440355-37
5 54188463 Hiralal Nahar Leelabai Nahar Leelabai Nahar Leelabai Nahar Leelabai Nahar Leelabai Nahar Leelabai Nahar Bhagawandas Sevaram Pahuja 30 16217614-615 404554678 2207869416 6 33116578 Kirankumar Ambalal Patel Bhagawandas Sevaram Pahuja 30 16217614-615 404554678 404557678 7 33708246 Nina Y Songavker 40 4335515-516 69919598 6063366200 8 119114180 R S Pahwa Arushi 54 57644526-526 1598246816 66315742-742 686326620 9 83336391 Shah Kalpana Ben Rajesh Kumar Ambalal 1 50426948-948 116037777 6862180644 10 705756 Sneh Todi 64 51419599-600 117789087-606 11 1118790 Sona Devi Dinesh Kumar Gupta 50 6314924-924 133666785 687305269 12 63939170 Suresh Prasad 100 62592087-087 221762816 221762816 13 14013041 Vandana D Mehta Apurva D Mehta Apurva D Mehta Apurva D Mehta 180 66474857-857 685918900			•	110	16618396-398	465751835-94
Celabai Nahar				85	53713682-684	1258359035-11
6 33116578 Kirankumar Ambalal Patel Bhagavandas Sevaram Pahuja 30 16217614-615 404554675 7 33708246 Nina Y Songavker 40 4335515-516 6991959 8 119114180 R S Pahwa 54 62308894-894 2193004399 8 119114180 R S Pahwa 54 57644526-526 1598246818 9 83336391 Shah Kalpana Ben Rajesh Kumar 1 50427098-098 116037772 8hah Rajesh Kumar Ambalal 1 59209516-516 19838127 10 705756 Sneh Todi 64 51419599-600 117789087- 11 1118790 Sona Devi 3 560939-939 16909952 11 1118790 Sona Devi 3 560939-939 16909952 12 63939170 Suresh Prasad 100 62592087-087 221762816 12 63939170 Suresh Prasad 100 62592087-087 221762816 13 14013041 Vandana D Mehta Apurva D Mehta Apurva D Mehta 66669557-557	5	54188463	Hiralal Nahar	20	50886108-108	1164675564-58
Bhagavandas Sevaram Pahuja 30 62342710-710 2195810477 33708246 Nina Y Songavker 40 4335515-516 6991959 10 7471776-776 146942016 50 62308894-894 2193004399 1000 66531189-189 6863266200 1000 66531189-189 6863266200 1000 66531189-189 6863266200 1000 665311492-626 2199228593 15840 1000 66515742-742 6862180644 1000 66515742-742 6862180644 1000 66515742-742 6862180644 1000			Leelabai Nahar	40	62463798-798	2207869410-44
7 33708246 Pahuja 30 62342710-710 2195810475 6991959 10 7471776-776 146942016 50 62308894-894 2193004395 100 66531189-189 6863266200 66515742-742 6862180644 62299109-109 2192285935 108 66515742-742 6862180644 62586464 62695742-742 6862180644 62695742-742 6862180644 62695742-742 6862180644 62695742-742 6862180644 6269576-076	6	33116578	Kirankumar Ambalal Patel	30	16217614-615	404554675-70
7			Bhagavandas Sevaram			
10			Pahuja	30	62342710-710	2195810475-50
Section	7	33708246	Nina Y Songavker	40	4335515-516	69919599-63
8 119114180 R. S. Pahwa 54 57644526-526 1598246816 Arushi 54 62299109-109 2192285935 108 66515742-742 6862180646 66515742-742 6862180646 66515742-742 6862180646 66515742-742 6862180646 6707792 670798-098 670798				10	7471776-776	146942016-02
8 119114180 R S Pahwa Arushi 54 57644526-526 1598248816 219228595 9 83336391 Shah Kalpana Ben Rajesh Kumar Shah Rajesh Kumar I S0427098-098 1 50426948-948 116037772 10 705756 Sneh Todi 64 59209516-516 19838127. 64 62395076-076 2200778118 64 6644823-823 687305269 11 1118790 Sona Devi Sona Devi Sona Devi Sona Sona Devi Sona Sona Sona Sona Sona Sona Sona Sona				50	62308894-894	2193004399-44
Arushi				100	66531189-189	6863266202-30
9 83336391 Shah Kalpana Ben Rajesh Kumar I 50426948-948 116037777 Shah Rajesh Kumar I 50426948-948 116037777 Shah Rajesh Kumar I 59209516-516 198381277 Shah Rajesh Kumar I 59209516-516 198381277 Shah Rajesh Kumar I 59209516-516 198381627 Shah Rajesh Kumar Gupta I 1118790 Sona Devi Joinesh Kumar Gupta Shah Rajesh Kumar Rajesh Kumar Shah Rajesh Kumar Rajesh	8	119114180	R S Pahwa	54	57644526-526	1598246816-86
9 83336391 Shah Kalpana Ben Rajesh Kumar I 50426948-948 116037777 Shah Rajesh Kumar I 50427098-098 116037792 Shah Rajesh Kumar I 59209516-516 198338127 10 705756 Sneh Todi 64 51419599-600 117789087-64 62395076-076 2200778118 64 66644823-823 687305269 11 1118790 Sona Devi 3 560939-939 1690995 Dinesh Kumar Gupta 50 6314924-924 13366678 53 62227102-102 218677955 12 63939170 Suresh Prasad 100 62592087-087 221762816: 200 66900881-881 689574398: 6876365002 13 14013041 Vandana D Mehta Apurva D Mehta Apurva D Mehta 14 110128251 Vijai Kumar Raghav 180 66474857-857 6859189009			Arushi	54	62299109-109	2192285955-00
Rajesh Kumar				108	66515742-742	6862180640-74
Shah Rajesh Kumar	9	83336391		1		1160377771-77
Ambala				l I		1160377921-92
10 705756 Sneh Todi						198381272-27
11 1118790 Sona Devi 64 6644823-823 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 6873052694 687305369				1		198396224-22
11 1118790 Sona Devi 3 560939-939 16909958 1690988 16909958 1690958 16909958	10	705756	Sneh Todi			1177890874-93
11 1118790 Sona Devi 3 560939-939 16909951 Dinesh Kumar Gupta 50 6314924-924 133666789 53 62227102-102 2186779553 63939170 Suresh Prasad 100 62592087-087 2217628162 6490881-881 6895743983 6490881-						2200778118-18
Dinesh Kumar Gupta 50 6314924-924 13366678 53 62227102-102 218677955 218677955 218677955 218677955 218677955 21867955 218677955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 21867955 2186795					l I	6873052699-76
12 63939170 Suresh Prasad 100 62592087-087 221762816; 200 66900881-881 689574398; 687636500; 6876365	Ш	1118790		_		16909958-96
12			Dinesh Kumar Gupta			133666789-83
13						2186779553-60
13	12	63939170	Suresh Prasad			2217628162-26
Apurva D Mehta 14 110128251 Vijai Kumar Raghav 180 66474857-857 6859189009						6895743982-18
14	13	14013041		76	66669557-557	6876365002-07
Neelam Raghau	14	110128251		180	66474857-857	6859189009-18
			Neelam Raghau			

The Public is hereby warned against purchasing or dealing with these securities any way. Any person(s) who has / have any claim in regard of the securities, should lodge such claim with the Company's Registrar and Transfer Agents viz. "KFin Technologies Private Limited", Selenium Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District, Nanakramguda Hyderabad - 500 032, within Seven (7) days from the date of publication of this not failing which, the Company will proceed to issue duplicate certificate(s) in respect of the

for Reliance Industries Limited

Savithri Parekh Date: 27th November. 2020

Joint Company Secretary and Compliance Officer

મિલકતોનું ઓનલાઇન ઇ–હરાજી વેચાણ

કોટક મહિન્દ્રા બેંક લીમીટેડ **kotak**

૨૪૩૨૩ ં ઓફીસ : ૨૭ બીકેસી, સી–૨૭, જી–બ્લોક, બાંદ્રા કુર્લા કોમ્પલેસ, બાંદ્રા (ઇસ્ટ), મુંબઇ, મહારાષ્ટ્રા–૪૦૦ ૦૫૧, **શાખા ઓફીસ** : પાંચમો માળ, અદામસ પ્લાઝા, ૧૬૬/૧૬, સીએસટી રોડ, કાલિના, સાંતાકુઝ (ઇસ્ટ), મુંબઇ–૪૦૦૦૯૮

સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ

લેક્ચોરીટી ઇન્ટરેસ્ટ (એનફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ ના નિયમ ૮(૫) અને ૮ (૬) ની જોગવાઇઓ સાથે વેત્રાતા નિયમ ૮ (૫) સાથે વંત્રાતા સિક્ચોરીટાઇઝેશન અને રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ અને એનફોર્સમેન્ટ ઓફ સિક્ચોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ,સ્૦૦૨ હેઠળ સ્થાવર મિલકતોના વેચાણ માટે ઈ-હરાજી વેચાણ નોટીસ્ ભુભુજ ફાયનાન્સ લીમીટેડ એસાઇનમેન્ટ એગ્રીમેન્ટ તા.૨૭.૧૨.૨૦૧૭ દ્વારા કોટક મહીન્દ્રા બેંક લીમીટેડની તરફેણમાં ડેબ્ટ સોપ્યા છે અને આથી ખાસ કરીને દેવદાર(રો ઝને જામીનદાર(રો) અને જાહેર જનતાનો નોટીસ આપવામાં આવે છે કે નીચે જણાવેલ સ્થાવર મિલકતો સિક્ચોર્ડ લેણદારને મોર્ગેજ્ડ કરાઇ છે જેનો કબજો કોટક મહીન્દ્ર બેંકના અધિકૃત અધિકારીએ ૨૩.૧૨.૨૦૧૯ ના રોજ મેળવી લીધેલ છે, જેનું શ્રી નીતીન ઠક્કર, શ્રીમતી ગીતા નીતીન ઠક્કર, શ્રી મુળરાજ ઠક્કર અને ઓમ નેચરલ ગેર ક્ષીલીન્ડર્સ પ્રાઇવેટ લીમીટેડ, તેના અધિકૃત સહી કરનાર શ્રી નીતીન ઠક્કર વતી, પાસેથી કોટક મહીન્દ્રા બેંક લીમીટેડ, સિક્ચોર્ડ લેણદારની લોન એકાઉન્ટ ન .130HL.00082292 અને 4130HL.00082295 હેઠળની રૂ.. ૩,૦૭,૮૧,૬૮૮/– (રૂપિયા ત્રણ કરોડ સાત લાખ એક્યાસી હજાર છસો ઇઠ્યાસી પુરા) ર. ૧.૧૨.૨૦૨૦ મુજબની બાર્ક રકમ તેમજ વસુલાત સુધી લાગુ વ્યાજ સહીત વસુલવા માટે જ્યાં છે જે છે અને જેમ છેના ધોરણે ૩૦.૧૨.૨૦૨૦ ના રોજ બપોરે બરે:૦૦ થી ૦૨:૦૦ વાગ્યા સુધી પ મિનિટન અમર્યાદિત લંબાણ સહીત વેચાણ કરવામાં આવશે. રીઝર્વ કિંમત રૂા, ૩,૦૦,૦૦,૦૦૦/– (રૂપિયા ત્રણ કરોડ પુરા) રહેશે અને ઇણએડી રૂા. ૩૦,૦૦,૦૦૦/– (રૂપિયા ત્રીસ લાખ પુરા) રહેશે. ઇએમડી અને કેવાચરી સુપરત કરવાની છેલી તારીખ ૨૯.૧૨.૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યા સુધી રહેશે.

ર કે કે કે કે મિલકતની વિગત ૧: ક્લેટ ને. ૫૦૧, પાંચમો માળ, વિંગ-બી, સ્કીકલ બિલ્ડીંગ, ક્ષેત્રફળ ૭૦૭ સો.કુંટ, પંત નગર, ઘાટકોપર-કિરોલ, રજીરટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ કિર્ટ્રીક્ટ મુંબઇસીટી અને મુંબઇસબઅરબન કિર્ટ્રીક્ટ, ક્ષેત્રફળ ૬૯૪.૭૬ સો.મી. અથવા ૬૬૮.૭૭ સો.મી, મહડ ડેમરકેશન મજબ)સીટીસર્વે નં. ૫૭૪૦, ગામ ઘાટકોપર કુંજ, ઘાટકોપર (પુર્વ), મુંબઇ–૪૦૦ ૦૭૭, મુંબઇ મ્યુન્શિપલ કોર્પોરેશનના એન વોર્ડ ની હદમાં, આવેલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. મિલકત હાલમાં જાણતી છે: ક્લેટ . ૫૦૧, પાંચમોમ ાળ, વિંગ બી, રિકીફ બિલ્ડીંગ, શ્રમ સફલ્યા કો.હા.સો.લી., ક્ષેત્રફળ ૭૦૭ ચો.ફુટ કાર્પેટ એરિયા ધરાવતી પંત નગર, ઘાટકોપર, ઇસ્ટ મુંબઇ– ૪૦ ગાતે આવેલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા.

સે ક્યોર્ડ મિલકતની વિગત ૨ : ટાઇટલ દરતાવેજમુજબ: ફલેટ નં. ૫૦૨ , પાંચમો માળ , વિંગ બી , સ્કીફ બિલ્ડીંગ ક્ષેત્રફળ ૮૩૨ ચો .ફુટ, પંત નગર ઘાટકોપર–કિરોલ, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અને સબ ડિસ્ટ્રીક્ટ મુંબઇ સીટી અને મુંબઇ સબઅરબન ડિસ્ટ્રીક્ટ, ક્ષેત્રફળ ૬૯૪.૭૬ સો.મી. અથવા ૯૬૮.૭૭ સો.મી , મહેડ ડેમરકેશન મજ્બ)સીટી સર્વે નં. ૫૭૪૦ ગામ ઘાટકોપર, કુંજ, ઘાટકોપર (પૂર્વ), મુંબઇ-૪૦૦ ૦૭૭, મુંબઇ મ્યુન્સિપલ કોર્પોરેશનના એન વોર્ડ ની હદમાં, આવેલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા મિલકત હાલમાં જાણીતી છે: ૫૦૨, પાંચમો માળ, વિંગ બી, રકીફલ બિલ્ડીંગ, શ્રમ સફલ્થ કો.ઓ.હા. સો. ક્ષેત્રફળ ૮૩૨ ચો.ફુટ કાર્પેટ એરિયા રાવતી પંત નગર, ઘાટકોપર

ઇસ્ટ મુંબઇ ૪૦૦૦૭૭ ખાતે આવેલ મિલકતના તમામ ભાગ અને હિસ્સા. સિક્ચોર્ડ એસેટ પરત મેળવવા માટે ઉપલબ્ધ સમય મર્ચાદા અંગે એક્ટની કલમ ૧૩ ની પેટા કલમ ૮ની જોગવાદઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે. ખાસ કરી દેવદાારો અ ને જાહેર જનતાએ નોંધ લેવી કે જો અહી જણાવેલ હરાજી શ્રીડ્યુલ્ડ કોઇ કારણસર નિષ્ફળ જાયતી સિક્યોર્ડ લેણદાર ખાનગી સંધીથી વેચાણના માર્ગે સિક્યોરીર્ટ ઇન્ટરેસ્ટનો ઉપયોગ કરી શકે છે. વેચાણ હેઠળની મિલકતોના સાબંધમાં કોઇપણ સ્પષ્ટતા/જરૂરીયાતના કિસ્સામાં બીડસે શ્રી સજેન્દ્ર દહીયા (+૯૧ ૮૪૪૮૨૬૪૫૧૫), શ્રી આકાર ાક્સેના (+૯૧ ૮૮૬૦૦૦૧૯૧૦), શ્રી પંકજ રાચ (+૯૧ ૭૭૬૮૦૦૩૫૬૭) અને શ્રી નિક્કી કુમાર (+૯૧ ૭૦૪૫૯૦૦૫૫૧) નો સંપર્ક કરી શકે છે. વેચાણની વિગતવાર શરતો અન નિચમો માટે કોટક મહીન્દ્રા બેંકની વેબસાઇટ www.kotak.com પર આપેલ લિંક https://www.kotak.com/en/bank-auctions.html અને/અથવ nttps://kotakbank.auctiontiger.net જોવા વિનંતી છે.

થળઃ મુંબઇ, તારીખઃ ૨૭.૧૧.૨૦૨૦ અધિકૃત અધિકારી: કોટક મહીન્દ્રા બેંક લીમીટેડ



Bengaluru, November 27, 2020

INGERSOLL-RAND (INDIA) LIMITED

CIN: L05190KA1921PLC036321 Regd. Office: First Floor, Subramanya Arcade, Bannerghatta Road, Bengaluru - 560 029 Phone: +91 80 46855100; Fax: +91 80 4169 4399; Website: www.irco.com

POSTAL BALLOT NOTICE

Members of the Company are hereby informed that pursuant to Section 110 of the Companies Act, 2013 read with Rule 22 of Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with the Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 22/2020 dated June 15, 2020 and Circular No. 33/2020 dated September 28, 2020, issued by the Ministry of Corporate Affairs and pursuant to other applicable laws and regulations, the Company has sent e-mail on November 27, 2020 through National Securities Depository Limited (NSDL) to the members who have registered their e-mail ID with depositories or

The Company seeks consent of the members by way of ordinary resolution on the matters relating to (a) approval to enter into Related Party Transactions with Ingersoll Rand Industrial US Inc (b) approval to enter into Related Party Transactions with Ingersoll Rand Industrial US Inc (b) approval to enter into Related Party Transactions with Ingersoll Rand Industrial Ireland Limited and (c) re-classify Transactions with Ingersoll Rand Industrial Ireland Limited and (c) re-classify Transactions with Ingersoll Rand Industrial Ireland Limited and (c) re-classify Transactions as a public shareholder category as detailed in Postal Ballot Notice dated November 24, 2020 read together with the explanatory statement annexed to the Notice through Postal Ballot only by voting through electronic means (remote evoting). Postal Ballot Notice has been uploaded on the Company's website **www.irco.com**

The Company is pleased to offer remote e-voting facility to all those persons who are members of the Company as on November 23, 2020 (cut-off date) to enable them to cast their vote by electronic means and a person who is not a Member as on the cut-off date should treat this Notice for information purposes only.

The Board of Directors has appointed Mr. Natesh K, Practicing Company Secretary as the Scrutinizer for conducting the remote e-voting process in a fair and transparent manner. The voting through electronic means shall commence on December 1, 2020 (9.00 am IST) and end on December 30, 2020 (5.00 pm IST). The voting by electronic means shall not be allowed beyond 5.00 pm IST on December 30, 2020.

In compliance with the aforesaid MCA Circulars, the Postal Ballot Notice has been sent only through electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members who have not registered their e-mail id or have not received e-mail sent through NSDL may write either to the Company's Registrar and Share Transfer Agents at csg-unit@tsrdarashaw.com or to the Company at Pramod.Hegde@irco.com and obtain the same.

The results of the postal ballot shall be declared on December 31, 2020. The results along with the Scrutinizer's report would be communicated to the Stock Exchanges where the Company's shares are listed and will also be displayed on the Company's website www.irco.com

The resolutions passed by the Members through remote e-voting will be deemed to have been passed as if the same were passed at a general meeting of the Members convened in that regard. The resolution, if approved by requisite majority of Members by means of remote e-voting, shall be deemed to have been passed on the last date of remote e-voting i.e. December 30, 2020.

Any query or grievance connected with the e-voting can be addressed to Ms. Sarita Mote, Assistant Manager, NSDL, 4th Floor, 'A' Wing, Trade World, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, Mumbai 400 013. E-mail: evoting@nsdl.co.in, Toll Free No. 1800222990.

For INGERSOLL-RAND (INDIA) LIMITED P.R. SHUBHAKAR General Manager - Corp. Finance

& Company Secretary

વેચાણ નોટીસ પીએસએલ લીમીટેક (ફક્ચામા) કડ્યા અદિકારી: શ્રી નિતિન જેન ફક્યા અધિકારીનું સરનામું: ઇ-૧૦એ, કૈલાશ કોલોની, નવી દિલ્હી ૧૧૦૦૪૮ દામેલા: <u>assetsale1@aaainsolvency.com</u>. nitinjain@aaainsolvency.com મોબાઇલ: ૮૮૦૦૮૬૫૨૮૪ (પુનીત સંચદેવા) /૦૧૧–૪૬૬૬૪૬૨૮ (શ્રીમતી હર્ષિતા)

ઇન્સોલ્વેન્સી અને બેંકપ્ટસી કોડ, ૨૦૧૬ હેઠળ મિલકતોનું વેચાણ –હરાજીની તારીખ અને સમયઃ ૨૮ કિસેમ્બર, ૨૦૨૦ ના રોજ ૨.૩૦ પીએમ થી ૬.૦૦ પીએમ સુધી (૫ મિનિટના અમર્યાદિત લંબાણ સહીત માનનીય નેશનલ કંપની લો ટીપ્યુનલ, અમદાવાદ બેંન્ચના હુકમ તા.૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૦ ફારા નિમાચેલ ફડશા અધિકારી દ્વારા રસાચેલ લિક્વીડેશન એસ્ટેટનો ભાગ બનતી પીએસએલ લીમીટેડ (ફડશામાં) ની માલિકીની એસેટો અને મિલકતોનું વેશાણ વેશાણ નીચે સહી કરના દ્વારા ઈ–હરાજી પ્લેટફોર્મ https://aaa.auctiontiger.net મારફત કરવામાં આવશે.

મિલકતો	બ્લોક	રીઝર્વ કિંમત	પ્રારંભિક ઇએમડીની સ્ક્રમ		ની કિં રૂ .માં)
વિકલ્પ/બ્લોક એ (કોર્પોરેટ દેવાદાર, ચાલુ પેઢી તરીકે)					
કોર્પોરેટ દેવાદારની તમાતમ મિલકતો , આઇબીબીઆઇ (ફડ્યા પ્રક્રિયા) નિયમનો, ૨૦૧૬ ના નિયમન ૩૨ એ મુજબ ચાલુ પેદીના ધોરણે	A*	425.50	15.00	1	કરો
વિકલ્પ/બ્લોક બી (ચાલુ પેઢી તરીકે કોર્પોરેટ દેવાદાર)					
યાલ પેટના ધોરણે, કોર્પોરેટ દેવાદારના કાંચુપુરણ-દીએન, શ્રાિખાપટ્ટનમ-એપી, વસ્સાણા-છુજે, જ્યપુર-આરજે, ખાતે આવેલ ૪ ઓપરેશનલ પ્લાન્ટ અને ઓપરેશનલ ફાચનાનિસ્થલ એસેટો	B*	264.00	10.00	1	કરો
વિકલ્પ/બ્લોક સી (પીસમીલ ધોરણે)					
પી.બી. નં. ૨૫, કાંચીગામ, દમણ (ચુટી)ક ૩૯૬ ૨૧૦ ખાતે આવેલ બિલ્ડીંગ અને પ્લાન્ટ અને મશીનરી	C1	1.75	0.175	2	au
પિથમપુર ઇન્ડસ્ટ્રીચલ એરિચા, બજરંગપુરા, મધ્યપ્રદેશ ૪૫૪૭૭૫ ખાતેની પ્લાન્ટ અને મશીનરી	C2	5.50	0.55	3	લા
સર્વે નં. ૩૭૭/૨, ગામ કાંચીગામ, નાની દમણ, ઝરી કોઝવે સેડ, દમણ ખાતેની જમીન (૨૧.૭૪ એકર)	C3	35.00	3,50	5	СU
પીએસએલ ટાવર,દ્વપ, મક્વાણા રોડ,(ઓફ અંધેરી કુર્વા રોડ),સ્ટાર પ્લસ ઓફીસ પાછળ, મારોલ, અંધેરી (ઇસ્ટ), મુંબઇ ૪૦૦૦૫૯.	C4	46.00	4.60	5	ец
કોર્મસીચલ ઓફીસની જગ્યા, બી ૩૦૭, ત્રીજો માળ,વર્ધમાન ચેમ્બર્સ પ્રિમાદસીસ કો–ઓપ ક્ષોસાચટી લીમીટેડ, પ્લોટ નં. ૮૪, સેક્ટર નં.૧૭, વશી, નવી મુંબઇ ૪૦૦ ૭૦૫ (૨,૩૫૦ ચો.ફ્ટર– બિલ્ટ અપ એરિયા)	C5	3.25	0.32	2	аı
કોર્મસીચલ ઓફીસની જગ્યા, બી ૩૧૬, ત્રીજો માળ,વર્ધમાન ચેમ્બર્સ પ્રિમાદસીસ કો-ઓપ ક્ષોસાચટી લીમીટેડ, પ્લોટ નં. ૮૪, સેક્ટર નં.૧૭, વશી, નવી મુંબઇ ૪૦૦ ૭૦૫ (૨,૩૫૦ ચો.ફ્રટ- બિલ્ટ અપ એરિયા)	C6	3.25	0.32	2	GI
રેસીડેન્સીચલ બંગલો, પ્લોટ નં.૧૪૪, પર્સિક હિલ,ઓફ ઉરણ રોડ, રોક્ટર, ર૭, ગામ સીબીડી બેલાપુર, તાલુકો અને જિલો થાને, નવી મુંબઇ, મહારાષ્ટ્ર ૪૦૦૬૧૪ (૪,૭૩૦.૪ શો.ફુટ)	C7	8.50	0.85	3	GI
કોર્મસીચલ પ્રિમાદાસીસ નં. દ!–૧, ઇં–૨, અને ઇં–૩, પહેલો માળ, શીવ પાર્વતી શોપીંગ કોમ્પલેસ, ત્લોટ નં. ૧૦૬–૧૧૦, સેક્ટર –૨૧, નેરૂલ પુર્વ, નવી મુંબઇ ૪૦૦૭૦ (૨,૦૩૧ ત્રો. ફુટ) કાર્પેટ એરિયા	C8	3.80	0.38	2	GII
સર્વે નં. ૧૨૩ (પી) અને ૧૨૪, મહુડી રોડ, ગામ– ખાડત, તાલુકો માણસા, જિલો ગાંધીનગર, ગુજરાત ખાતેની જમીન (૨૧.૦૪ એક્૨)	C9	13.00	1.30	3	GI
ટેવન્થુ સર્વે નં.૧૮,૩૭ અને ૫૦, ગામ રામપરા–૨, તાલુકો– રાજુલા, જિન્નો અમરેલી, ગુજરાત ૩૬૫૫૬૦ ખાતેની જમીન (૧૬૯ એક્ટ)	C10	40.00	4.00	5	લા
લોટ નં. રએ, ૪, ૫, ૬એ, સર્વે નં. ૧૬૯/૧ પાર્ટ, ૧૭૩ પાર્ટ, ૧૭૬ પાર્ટ, એપીઆઇઆઇસી- આઇએએલએ,ઇન્ડસ્ટ્રીચલ પાર્ક– ફેઝ –૨,પેક્ષપુરમ ઇસ્ટ ગોદાવરી જિલો આંધ્ર પ્રદેશ (૩૨.૨૩ એક્૨)	C11	6.51	0.65	2	GI
કોર્મસીચલ ઓફીસની જગ્યા, જુનો પ્લોટ નં. ૮/૨એ, નવો નં. ૧૫/૨ અને જુનો પ્લોટ નં. ૮/૨બી, નવો નં. ૧૫/૩,ત મોન્ટીથ લેન એગમોર્ટ, લેક્ષઇ (૧,૭૫૦ સો.ક્રુટ)	C12	1.20	0.12	1	сц
ટેસીડેન્સીચલ ફ્લેટ, નવો નં. ૧૫/૧૬, જુનો નં. ૮/૧૫, સર્વે નં. ૧૬૦૫/૯, મોન્ટીથ લેન, ઝેગમોરે, ચેજ્ઞઇ (૧,૨૩૫ સો.કુટ)	C13	0.75	0.075	50	ē٩
લોટ નં. બી–૯૬, પીએસએલ હાઉસ, ગ્રેટર કૈલાશ પાર્ટ–૧, નવી દિલ્હી ૧૧૦૦૪૮ (ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ)(૭૧૬.૫૮ શો.મી)	C14	17.99	1.70	5	aı
આચર્ન ઓરે માઇન , ઠાક્સેનકી ધાની (બછારી ગણેશપુરા), તાલુકો શાહપુરા, જિત્તો જ્થપુર - 303903	C15	2.50	0.25	1	сц
પીએસએલ કોરોઝન કંટ્રોલ સર્વિસીઝ લીમીટેડમાં ૧૦૦ ટકા ઇક્વીટી રોકાણ	C16	15.00		3	сu
યુરોકોસ્ટીક પ્રોડક્ટ્સ લીમીટેડમાં ૧૮.૨૫ ટકા ઇક્વીટી રોકાણ	C17	4.29	0.42	3	ец
ીએએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પોર્ટસ પ્રાઇવેટ લીમીટેડમાં ૧૦૦ ટકા રોકાણ	C18	4.30	0.43	3	сu
\\(\)\(\)\(\)\\\\\\\\\\\\\\\\\\\\\\\\\	C19	0.15	0.015	50	ē٩
અન્ય એસોસિયેટ્સમાં રોકાણ	C20	9,44	0.94	1	GU

અને બ્લોક સી (સી૧– સી૨૦(કરતા) અગ્રીમતા આપવામાં આવશે, એટલે કે જો બ્લોક એ માટેની રીઝર્વ કિંમતને સમાન અથવા તેના કરતા ઉર્ચી ીડ મળશે તો બ્લોક બી અને બ્લોક રી (સીવ-સી૨૦) માટેની બીડો રદ કરવામાં આવશે અને તમામ ફોક ગણાશે, સિવાય કે જ્યારે બ્લોક એ મારે ળેલ બીડની કરતા બ્લોક બી અને બ્લોક સી (સીવ- સી૨૦) બેને હેઠળ મળેલ સફલ બીડો ઉમેરવાથી મળતી સંચુક્ત બીડની ૨કમ ઉંઘી હશે મામ એસેટો અને બ્લોક એ,બી અનેસી (સી૧– સી૨૦) ની વિગતો તેમજ કોછપણ પડતર કાનુની કેશ/ ચાલુ મુકદમાં/બરતરફી નોટીસ માહી મોરેન્ડમ દસ્તાવેજોમાં છતા કરાચેલ છે અને હરાજીમાંભાગ લેતા પહેલા ફરજિયાત પણે જોઇ શકાશે.

ો સ્પષ્ટ કરવામાં આવે છે કે આ આમંત્રણનો આશચ સંભવિત બીડરોને આવકારવાનો છે અને કડચા અધિકારી અથવા કંપની માટે વેચાણ પ ડ્યા માટે કોઇપ્રકારે બંધનકર્તા નથી. ફડયા અધિકારી કોઇપણ કારણ જુણાવ્યા વગર અને કોઇપણ જ્વાબદારી વગરપ્રક્રિયા રદ અથવા ફેરફા ને/અથવા સ્વીકાર ન કરવા અને/અથવા રસ ધરાવતી વ્યક્તિ/સંભવિત રોકાણકાર/બીડરને ગેર લાયક ઠેરવવાનો અનામત હક ધરાવે દ - હરાજી જ્યાં છે, જેછે અને જેમ છે ના ઘોરણે સર્વિસ પ્રદાતા મે.ઇ-પ્રોક્યુરમેન્ટ ટેક્નોલોજી લીમીટેડ (ઓક્શન ટાઇઘર) મારફત ચોજાશે. હરાજ મામ શરતો અને નિયમો https://insolvencyandbankruptcy.in/public-announcement/psl-limited/ ર tps://aaa.auctiontiger.net પર ઉપલબ્ધ વિગતવાર દસ્તાવેજોમાં જ્યાવેલ છે.

પીએસએલ લીમીટેડની બાબતમાં ફડ્યા અધિક IBBI (IBBI-001/IP-P-01562/2019-2020/12462 સરનામું: ઇ-૧૦એ, કૈલાંશ કોલોની, ગ્રેટર કૈલાશ ૧, નવી દિલ્હી, -૧૧૦૦ દમેદાવ: nitinjain@aaainsolvency.com, psl.limited@aaainsolvency.com, assetsale1@aaainsolvency.com संपर्डंडर्ता व्यक्तिः पुनित संबद्देवा/श्री नीतीन क्षेन +६१- ८८००८६५२८४ / ०११ -४६६६५६१

इंडियन बैंक

🛆 इलाहाबाट

Indian Bank ALLAHABAD

વસ્ત્રાલ શાખા. સહાજ કોમ્પલેક્ષ, કર્ણાવતી મેગા મોલની સામે, વસ્ત્રાલ **ञ्चोन : ०७**૯–२२**८७**१७८७

ઈ-હરાજી તા. ૧૫.૧૨.૨૦૨૦ ને સવારે ૧૧.૦૦ થી ૩.૦૦ કલાંકે સરકેસી કાયદો ૨૦૦૨ દેઠળ 'જેમ છે જ્યાં છે, જે છે એ છે' અને જે કાંઈ છે' તેના આધારે ઈ-ફરાજી પ્લેટફોર્મ વેબસાઇટ https://www.mstcecommerce.com પર ઈ-ફરાજી કરવામાં આવશે.

શ્રી પ્રદિપભાઈ કનુભાઈ લખાણી

અચલિત મિલકતની વિગત (મૃત્યક્ષ કબરો) ફ્લેટ નં. એ–૧૨, ત્રીજો માળ, શ્રીનાથ રેસેકિન્સી, ઈન્દ્રનગર ટેકરાની સામે, અશ્વમેઘ રો હાઉસની બાજુમા, ઓઢવ, અમદાવાદ ૩૮૨૪૧૫ માં આવેલ બધા હક ને હિસ્સા સાથેની ફ્રી હોલ્ડ રહેણાંક મિલકત. મિલકતની ચતુર્સીમા : ઉત્તર : ખુલી જગ્યા, દક્ષિણ : કોમન સીડીઓ અને ફ્લેટ નં. એ ૧૩, પૂર્વ ખુલી જગ્યા. પશ્ચિમ : ફ્લેટ નં. એ ૧૧.

બોજા ની વિગતો, લોકલ સેલ્ફ ગર્વ. ઈલેક્ટ્રીકસીટી, પ્રોપર્ટી ટેક્ષ, મ્યુ. ટેક્ષ વગેરે બાકી, અધિકૃત અધિકારીની શ્રેષ્ઠતમ જાણકારી અને માહિતી મુજબ ઉપર જણાવ્યા સિવાય અહીં જે કંઈ બેંકના જાણ હોય ૧. શ્રી પ્રદિપભાઈ કનુભાઈ લખાણી (કરજદાર અને ગીરોકર્તા) . શ્રીમતી રેખાબેન પ્રદિપભાઈલખાણી (કરજદાર અને ગીરોકર્તા) જામીનદારો અને ગીરોકર્તાઓના નામ રૂ. ૧૦,૬७,૩૫૦/- તા. ૦૬.૧૨.૨૦૧૯ ની કિમાન્ડ નોટીસ મુજબ+ જે તે તારીખ સુધીનું સુરક્ષિત દેવાની રકમ વ્યાજ અને ખર્ચ, કિંમત અને ચાર્જ અને અન્ય ખર્ચ. રીઝર્વ કિંમત 🕽 ૩. ૧૨.૦૦ લાખ રૂ. ૧.૨૦ લાખ (રીઝર્વ કિંમતના ૧૦%) અર્નેસ્ટ મની કીપોઝીટ On 11.12.2020 up to 3.00 P.M., E-auction through https://www.mstcecommerce.com ઈએમડી રકમ સાથે ફોર્મ ભરવાની છેલી તારીખ અને સમય Registration should be completed by Intending bidder on or before EMD Date and there should be EMD balance in global wallet. તા. ૧૫.૧૨.૨૦૨૦, સવારે ૧૧.૦૦ વાગ્યાથી બપોરે ૩.૦૦ વાગ્યા સુધી અસીમિત વધારા ઈ–હરાજીની તારીખ અને સમય | સાથે. બીક વધારવાની રક્રમ રૂ. ૧,૦૦,૦૦૦/-

વધુ વિગત તેમજ શરતો અને નિયમો માટે : વધુ માહિતી તેમજ શરતો અને નિયમો કાઉનલોક કરવા માટે જુઓઃ સંપર્ક : શ્રી અનિલ કે ગૌતમ, ફોન : 22971797. l. https://www.indianbank.in. II. https://www.tenders.gov.in મોબાઈલ : 9426016797, E-mail: vastral@indianbank.co.in | III. https://www.mstcecommerce.com, IV. https://www.ibapi.in

તારીખ : ૨૩.૧૧.૨૦૨૦, સ્થળ : અમદાવાદ નોંધ : આ નોરિસ કરજદાર/જામીનદારો/ગીરોદારને ઉપરોક્ત લોન માટે ઉપરોક્ત તારીખે અને દરાયેલ વિગતો સાથે રાખેલ વેચાણ માટેની પણ છે. **ઇપ્યુક** બિક્ટો માટે અગત્યની નોંઘ - બિક્ટોને નીચેની ફોરમલીટી સારી રીતે અગાઉથી પૂર્ણ કરવાની રહેશે. નં. ૧ : બિક્ટ/ખરીદાર રજીસ્ટ્રેશનઃ બીક્ટ ઇ-જ્યું કાળકરા નાદ અનાવાલા લાય - ાબડરાન નાચના ફારમલાટા સારો રીત અગાઉથી પૂરો કરવાની રહેશે. નં. ૧ : બિકર/ખરીદાર રજીસ્ટ્રેશનઃ બીકર ઈ– કરાજી પોર્ટલ (ઉપર જણાવેલ લિંક) https://www.mstcecommerce.com પર રજીસ્ટ્રેશન કરવું. તેમનો મોબાઇલ નંબર અને ઈ–મેલ આઇડીને ઉપયોગ કરવો. નં. ૧ : કેવાયસી ચારાસણીઃ બીકર ને જરૂરી કેવાયસી કોક્યુંગેન્ટ અપલોક કરવા. કેવાયસી કોક્યુંગેન્ટ ની ચકાસણી ઈ–હરાજી સર્વિસ પ્રોવાણી ક્રારા કરવામાં આવશે. (બે કામકાજના દિવસો લાગી શકે છે.). નં. ૩ : ઇએમડી રકમ ગ્લોબલ ઇએમડી વોલેટમાં ટ્રાન્સફર કરો : એનાઇલને /ઑફલાઇન ટ્રાન્સફર ફંડ માં એનઇએફરી/ટ્રાન્સફર નો ઉપયોગ કરો, ઈ–હરાજી પોર્ટલ દ્વારા જનરેટ ચલણનો ઉપયોગ કરો. નં. ૧ થી ૩ ઈ-હરાજી તારીખથી પહેલા બીકરો દ્વારા સારી રીતે પૂર્ણ કરવું જોઈએ.

SUNIL HITECH ENGINEERS LIMITED (IN LIQUIDATION) Liquidator's Address- 416, Crystal Paradise Co-op Soc. Ltd. Dattaji Salvi Marg,

Above Pizza Express, Off Veera Desai Road, Andheri West, Mumbai – 400053; Contact: +91 9137058928; Email: auction.shel@gmail.com

E-AUCTION - SALE OF ASSETS UNDER IBC, 2016 Date and Time of Auction: 07th January 2021 (Thursday) at 1:00 P.M. to 2:00 P.M.

(with unlimited extension of 5 minutes each) Sale of Assets owned by SUNIL HITECH ENGINEERS LIMITED (In Liquidation) forming part of Liquidation

Estate under sec 35(f) of IBC 2016 read with Regulation 33 of Liquidation Process Regulations. E-Auction wil pe conducted on "AS IS WHERE IS AND AS IS WHAT IS BASIS".

The Sale will be done by undersigned through e-auction service provider E-PROCUREMENT TECHNOLOGIES LIMITED - AUCTION TIGER via website https://ncitauction.auctiontiger.net.

Sr. No.		Area (Sq. mtrs.)	Reserve price	EMD	Incremental Bid Amount		
1	Commercial Office at Runwal Platinum 2nd Floor S. No. 7 & 8 Plot No 3B Bavdhan Khurd, Pune	706.8	5,42,07,900	54,20,790	1,00,000		
2	Residential Bungalow at Plot No.4 Jai Nagar C.S. No. 684, Parli Vaijnath, Beed	450	1,49,50,650	14,95,065	50,000		
3	Residential Bungalow at 001,101 Bliss Apartment Plot No. 561-A Kachipura, Ramdaspeth, Nagpur	178.54	1,39,82,000	13,98,200	50,000		
4	Residential Flat at Flat A, Udhayam Vijaylaxmi Tower No. 1734, 18th Main Road, Anna Nagar, Chennai	204.38	1,32,25,000	13,22,500	50,000		
5	Residential Flat at B-202 Ujjwal Co-Op Housing Society, Udayan Complex,Ujjwal Nagar, Nagpur	58.45	21,73,500	2,17,350	30,000		
6	Land at Gut at No. 39 Moz.Sangam Tal - Parli Vaijnath	14,164	24,33,600	2,43,360	30,000		
Last data for Inspection : 02nd January 2021 (Saturday)							

Last date for Inspection : 02nd January 2021 (Saturday)
Last date of EMD submission : 04th January 2021 (Monday) up to 5:00 PM

Date and time of E-Auction : 07th January 2021 (Thursday) at 1:00 P.M. to 2:00 P.M. Note: The detailed Terms & Conditions, E-Auction Bid Document, Declaration & other details of online auction sale are available on https://ncitauction.auctiontiger.net and website of Sunil Hitech Engineers imited https://sunilhitech.com

In case of any clarifications, please contact the undersigned at auction.shel@gmail.com Date: 28th November 2020


Avil Menezes As Liquidator of Sunil Hitech Engineers Limited vide order dated 25th June 2019 IP Registration No.IBBI/IPA-001/IP-P00017/2016-17/10041 Address: 416, Crystal Paradise Co-op Soc Ltd, Dattaji Salvi Marg, Above Pizza Express, Off Veera Desai Road, Andheri West , Mumbai-400053 Email: auction.shel@gmail.com

જેકે પેપર લીમીટેડ

CIN: L21010GJ1960PLC018099 **นับสมเ**ระ: www.ikpaper.com **૨૪૧૨૮ કં ઓફીસ** : પી.ઓ. સેન્ટ્રલ પંપ મિલ્સ-૩૯૪ ૬૬૦, ફોર્ટ સોનગઢ, જિ. તાપી, ગુજરાત એડમીન ઓફીસ: નહેરુ હાઉસ, ૪ બહાદુર શાહ ઝફ્ફર માર્ગ, નવી દિલ્હી-૧૧૦ ૦૦૨ ફોન : +૯૧ ૧૧ ૬૬૦૦ ૧૧૩૨, ૨૩૩૧ ૧૧૧૧૨–૫, **ઇમેઇલ** : <u>sharesjkpaper@jkmail.com</u>

પોસ્ટલ બેલોટ નોટીસ

- ૧. આથી નોટીસ આપવામાં આવે છે કે કંપની કાયદા, ૨૦૧૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ ની જોગવાઇઓ અને અન્ય લાગુ જોગવાઇઓ જો કોઇ હોય તો તેની સાથે વંચાતા કંપની (મેનેજમેન્ટ અને એડમીનીસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૦ અને ૨૨, સેબી (લિસ્ટીંગ ઓબ્લીગેશન્સ અને ડિસક્લોઝર રીક્વાયરમેન્ટ્સ) નિયમો, ૨૦૧૫ ના નિયમન ૪૪ અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા જારી કરાયેલ (એમસીએ સરક્યુલરો) જનરલ સરક્યુલર નં. ૧૪/૨૦૨૦ તા.૮ એપ્રિલ, ૨૦૨૦, જનરલ સરક્યુલર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અને જનરલ સરક્યુલર નં. ૩૩/૨૦૨૦ તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ અન્વયે કંપનીએ ફક્ત ઇલેક્ટ્રોનિક માધ્યમો (રીમોટ- ઇ વોટીંગ) દ્વારા વોટીંગ દ્વારા પોસ્ટલ બેલોટ મારફત પોસ્ટલ બેલોટ ની નોટીસ તા. ૨૦મી નવેમ્બર, ૨૦૨૦માં જણાવેલ કાર્યોના સંબંધમાં કંપનીના સભાસદોની મંજુરી મેલવવા માટે પોસ્ટલ બેલોટની રવાનગી શુક્રવાર ૨૭ નવેમ્બર, ૨૦૨૦ ના રોજ પુર્ણ કરી છે. કંપની તેના સભ્યોને રીમોટ ઇ-વોટીંગની સવલત પૂરી પાડી રહી છે. રીમોટ ઇ-વોટીંગની સુનચાઓ પોસ્ટલ બેલોટની નોટીસમાં આપેલ છે.
- પોસ્ટલ બેલોટની નોટીસ જેમના નામો રજીસ્ટર ઓફ મેમ્બર્સ/ નેશનલ સિક્યોરીટીઝ ડિપોઝીટરી લીમીટેડ (એનએસડીએલ) અને સેન્ટ્રલ િડપોઝીટરી સર્વિસ (ઇન્ડિયા)લીમીટેડ(સી ડીએસએલ)પાસેથી પ્રાપ્ત લાભાર્થી માલિકોની યાદીમાં શુક્રવાર, ૨૦ નવેમ્બર, ૨૦૨૦(કટ ઓફ તારીખ)ના રોજ હાજર છે તેવા અને જેમણે એમસીએસ શેર ટ્રાન્સફર એજન્ટ લીમીટેડ, કંપનીના રજીસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આરટીએ) અથવા ડિપોઝીટરી પાર્ટીશીખ્ટ(ટો) પાસે તેમના ઇ-મેઇલ એડેસ રજીસ્ટર્ડ કરાવ્યા છે તે તમામ સભ્યોને ઇલેક્ટોનિક માધ્યમો મારફત મોકલવામાં આવી છે. જણાવેલ એમસીએ પરિપત્રો મુજબ પોસ્ટલ બેલોટની ફીઝીકલ નોટીસો તેમજ પોસ્ટલ બેલોટ ફોર્મ ફિઝીકલ સ્વરૂપે મોકવાની આવશ્યકતામાંથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી મુક્તિ આપવામાં આવે છે. તદ્દઅનુસાર કંપનીએ કોઇપણ સભ્યોને પોસ્ટલ બેલોટ નોટીસ અને પોસ્ટલ બેલોટ ફોર્મની ફીઝીકલ નકલો રવાના કરી નથી. કટ–ઓફ તારીખના રોજ સભ્ય ન હોય તેવી વ્યક્તિએ આ પોસ્ટલ બેલોટ નોટીસને ફક્ત માહીતીના હેતુસર લેવાની રહેશે.
- ૩. પોસ્ટલ બેલોટની નોટીસ કંપનીની વેબસાઇટ <u>www.jkpaper.com</u> અને સ્ટોક એક્સચેન્જોની વેબસાઇટ જ્યાં કંપનીના શેરો લીસ્ટેડ છે એટલે કે બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડની વેબસાઇટો અનુક્રમે <u>www.bseindia.com</u> અને <u>www.nseindia.com</u> પર ઉપલબ્ધ છે. પોસ્ટલ બેલોટની નોટીસ સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ રહેશે.
- ૪. રીમોટ ઇ-વોટીંગ ગાળો શનિવાર, ૨૮મી નવેમ્બર, ૨૦૨૦ ના રોજ સવારે ૧૦ઃ૦ વાગે શરૂ થશે અને રવિવાર, ૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ સાંજે પઃ૦૦ કલાકે પુર્ણ થશે. રીમોટ ઇ-વોટીંગ મોડ્યુલ જણાવેલ તારીખ અને સમય પછી માન્ય ગણાશે નહી. મતદાનના હકો કટ ઓફ તારીખના રોજ સભ્ય(યો)ના નામ(મો)માં રજીસ્ટડ શેરોની ભરપાઇ થયેલ મુલ્યને આધારે ગણવામાં આવશે. કંપનીએ યો ગ્ય અને પારદર્શક પદ્ધતિમાં રીમોટ ઇ-વોટીંગ પ્રક્યાિ મારફત પોસ્ટલ બેલોટના સંચાલન માટે શ્રી રામ નમો નારાયણ અગ્રવાલ, કંપની સેક્રેટરીની સ્ક્રુટીનાઇઝર તરીકે નિમણુંક કરી છે અને તેમની ગેરહાજરીમાં શ્રી નવીન કુમાર રસ્તોગી, કંપની સેક્રેટરીની, વૈકલ્પીક સ્ક્રુટીનાઇઝર તરીકે
- ૫. રીમોટ ઇ-વોટીંગના પરિણામો મંગળવાર, ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ અથવા એ પહેલા જારી કરવામાં આવશે. જારી કરાયેલ પરિણામો તેમ સ્ક્રુટીનાઇઝરનો અહેવાલ કંપનીની વેબસાઇટ <u>www.jkpaper.com</u> અને સીડીએસએલની વેબસાઇટ www.evotingindia.com પર મુકવામાં આવશે અને બીએસઇ લીમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડને
- ૬. ઇમેઇલ એડ્રેસ ૨જીસ્ટર/સુધારવાની રીત
- (એ) ફ્રીઝીકલ સ્વરૂપે શેરો ધરાવતા સભાસદો, જેમણે કંપનીમાં તેમના ઇમેઇલ એડ્રેસ ૨જીસ્ટર / સુધારો કરાયા નથી તેઓને નીચેના દસ્તાવેજોની સ્કેન્ડ નકલ કંપનીને <u>sharesikpaper@ikmail.com</u> પર ઇમેઇલથી મોકલવા વિનંતી છે.
- (૧)તમારા નામ, ફોલિયો નં. અને સરનામું જણાવતો સહી કરેલ વિનંતી પત્ર
- (૨)પાનકાર્ડની સ્વપ્રમાણીત નકલ અને
- (૩)સભાસદોના સરનામાને ટેકો આપતા કોઇપણ દસ્તાવેજની સ્વપ્રમાણીત નકલ (જેવા કે, આઘાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇલેક્શન ઓળખ કાર્ડ. પાસપોર્ટ)
- (બી) ડીમટીરીયલાઇઝડસ્વરૂપે શેરો ધરાવતા સભાસદો, જેમણે ડિપોઝીટ પાર્ટીશીપન્ટ(ટો)માં તેમના ઇમેઇલ એડ્રેસ રજસ્ટર/સુધારો કરાવેલ નથી તેઓને તેમના ડિપોઝીટરી પાર્ટીશીપન્ટ(ટો) પાસે તેમના ઇમેઇલ એડ્રેસ ૨જીસ્ટર/સુધારો કરાવવા વિનંતી છે.
- યોગ્ય ચકાસણી પછી, કંપની તેમના રજીસ્ટર્ડ ઇમેઇલ એડ્રેસ પર તેમની લોગીન ઓળખો મેળવવા માટેની પ્રક્રિયા આગળ વધારશે.
- ૭. ઇલેક્ટ્રોનિક માધ્યમોદ્વારા વોટીંગની સવલત સાથે સંકળાયેલ તમામ ફરિયાદો શ્રી રાકેશ દલવી, મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (ઇન્ડિયા) લીમીટેડ, એ વિંગ, ૨૫ મો માળ, મેરેથોન ફ્યુચરેક્સ, મફતલાલ મિલ કંપાઉન્ડસ, એન એમ જોષી માર્ગ, લોઅર પારેલ (પુર્વ), મુંબઇ- ૪૦૦૦૧૩ને જણાવાની રહેશે અથવા <u>helpdesk.evoting@cdslindia.com</u> પર ઇમેઇલ કરી શકેછે અથવા ૦૨૨ ૨૩૦૫૮૭૩૮/૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩ પર કોલ કરી શકે છે. કોઇપણ સહાય માટે કંપનીના સેક્રેટરીયલ ડિપોર્ટમેન્ટને ગુલાબ ભવન (પાછળનો બ્લોક), ૩જો માળ, ૬એ, બહાદુર શાહ ઝફર માર્ગ, નવી દિલ્હી-૧૧૦૦૦૨ ને લખવા વિનંતી છે.



જેકે પેપર લીમીટેક વતી સહી/-(દિપક ગુપ્તા) કંપની સેક્રેટરી